

M.Com Semester - 3 (CBCS) Examination

DEC/JAN. - 2020 [OLD COURSE]

ADVANCED COST & FINANCIAL ACCOUNTING(ELECTIVE)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન.૧ કોવીડ-19 વિક્સિન લી. ડિસ. 2020 માટે નીચેની વિગતો રજૂ કરે છે. (૧૪)

બજેટ મુજબ ઉત્પાદન	40,000 એકમો
ખરેખર ઉત્પાદન	44000 એકમો
વેચાણ	36000 એકમો
તા. 31-12-2020 ના રોજ તૈયાર માલનો સ્ટોક	14000 એકમો
એકમ દીઠ વેચાણ કિંમત	રૂ. 150
પ્રત્યક્ષ માલસામાન એકમ દીઠ	રૂ. 45
પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ	રૂ. 12
કારખાના ખર્ચ (ચલિત) એકમદીઠ	રૂ. 6
<u>સ્થિર ખર્ચ</u>	
કારખાના પરોક્ષ ખર્ચ	રૂ. 900000
વહીવટી પરોક્ષ ખર્ચ	રૂ. 500000
વેચાણ પરોક્ષ ખર્ચ	રૂ. 92000
સેલ્સમેનનું કમીશન ખરેખર વેચાણના 10%	

નીચેની પદ્ધતિથી નફો ગણો

1. ચલિત પડતર પદ્ધતિ
2. સમાવેશ પડતર પદ્ધતિ

પ્રશ્ન.૨ એક કંપની કે જેણે પડતર અને નાણાકિય હિસાબીની સંકલિત હિસાબી પદ્ધતિ અપનાવી છે તેના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો. (૧૪)

	રૂ.
1. માલ સામાનની ઉધાર ખરીદી	170000
2. જોબને પૂરો પાડેલ માલસામાન	120000
3. કુલ ચુકવેલ મજૂરી	90000
4. પરોક્ષ માલસામાન આપ્યો	8000
5. વેપારીને સ્ટોર્સમાંથી માલ પરત	10000
6. જોબ માટે ખાસ ખરીદેલ માલસામાન	30000
7. માલસામાનનો સામાન્ય બગાડ	1400
8. માલસામાનનો અસામાન્ય બગાડ	2300
9. પરોક્ષ મજૂરી	14000
10. જોબ ખાતે ઉધારેલ પ્રત્યક્ષ મજૂરી	73000
11. સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી	2000

12. અસામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી	1000
13. કારખાનાનો પરોક્ષ ખર્ચા ચૂકવ્યો	56000
14. કારખાના પરોક્ષ ખર્ચાની વસૂલાત	84000

પ્રશ્ન.૩ અમદાવાદ કંપનીના પડતરના ચોપડામાંથી મેળવેલ નીચેની બાકીઓ અને વ્યવહારો પરથી પડતર ખાતાવહીમાં જરૂરી ખાતાં બનાવો અને તા. 31-12-2020 ના રોજનું કાચુ સરવૈયું બનાવો. (૧૪)

તા. 01-01-2020 ના રોજની બાકીઓ

વિગત	ઉધાર બાકી રૂ.	જમા બાકી રૂ.
ચાલુ કામ ખાતાવહી નિયંત્રણ ખાતું	104000	-
તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતું	46000	-
કારખાના શિશેપઢી ખર્ચા ખાતું	1000	-
વહીવટી શિરોપરી ખર્ચ ખાતું	600	-
માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતું	23000	-
સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતું	-	174600
	174600	174600

વર્ષ દરમિયાન વ્યવહારો નીચે મુજબ છે.

પ્રત્યક્ષ મજૂરી	150000
પરોક્ષ મજૂરી	10000
ઉત્પાદન ખાતે વસૂલ કરેલ કારખાના ખર્ચ	44000
ઉત્પાદન ખાતે વસૂલ કરેલ વહીવટી ખર્ચ	24000
ઉત્પાદન અંગે આપેલ માલસામાન	98000
વર્ષ દરમિયાન થયેલ તૈયાર માલની પડતર	360000
વેચેલ તૈયાર માલ-પડતર કિંમત	380000
માલસામાનની ખરીદી	100000
કારખાનામાં રિપેર ઓર્ડર માટે મોકલેલ માલસામાન	4000
ઉત્પાદન માટે પૂરા પાડેલ માલસામાનનું આવક માલ ગાડા ભાડું	1600
કારખાના પરોક્ષ ખર્ચા	29000
વહીવટી પરોક્ષ ખર્ચા	23400
વેચાણ	420000

પ્રશ્ન.૪ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)

1. બેંચ માર્કિંગના ફાયદા અને મર્યાદાઓ
2. સમાન પડતર પદ્ધતિ અને આંતર પેઢી તુલનાના અર્થ અને મહત્વ
3. બેલેન્સ સ્કોરકાર્ડનો અર્થ ઉપયોગ અને મર્યાદાઓ
4. આંતર પેઢી તુલનાનો અર્થ અને હેતુઓ

પ્રશ્ન.૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)

1. સમતુંટ બિંદુ અને ચાવીરૂપ પરિબળો
2. સંકલિત અને બિન સંકલિત પદ્ધતિઓ તફાવત
3. સમાન પડતર પદ્ધતિના હેતુ અને મર્યાદાઓ
4. બિન સંકલિત પદ્ધતિના લાભા-લાભ

ENGLISH VERSION

- Q.1 Following informations has been provided by covid-19 Vexin Ltd. For the year ended Dec.2020 (14)

Budgeted production	40,000 Units
Actual production	44000 Units
Sales	36000 Units
Closing stock of finished goods as on 31-12-2020	14000 Units
Selling price per unit	Rs. 150
Direct material per unit	Rs. 45
Direct labour per unit	Rs.12
Factory over head (variable)	Rs. 6
<u>Fixed overhead</u>	
Factory over head	Rs. 900000
Administrative over head	Rs. 500000
Selling over head	Rs. 92000

Salesman commission @10% on actual sales.

Find out the profit with the help of following method.

1. Variable cost method.
2. Absorbtion cost method.

- Q.2 A company which used integrated Accounting method for cost and financial accounting. (14)
Write journal entries of the following transactions in books of this company.

	Rs.
1. Material purchased on credit	170000
2. Material provided to the job	120000
3. Total wages paid	90000
4. Indirect material provided	8000
5. Material return to the supplier from store	10000
6. Material purchased for special job	30000
7. Normal westage of material	1400
8. Abnormal westage of material	2300
9. Indirect wages	14000
10. Direct wages debited to the job	73000
11. Wages of normal non-productive time	2000
12. Wages of abnormal non-productive time	1000
13. Factory overhead paid	56000
14. Abjorbption of factory overhead	84000

- Q.3 With the help of following balances and transactions from the cost Accounts of Amdavad company,prepare varies required Accounts in cost ledger and prepare Trial balance as on 31-12-2020. (14)

Particulars	Debits Rs.	Credit Rs.
Work in progress ledger cont. A/c	104000	-
Finished good ledger cont. A/c	46000	-
Factory overhead A/c	1000	-
Administrative overhead A/c	600	-
Material Ledger cont. A/c	23000	-
General ledger cont. A/c	-	174600
	174600	174600

During the year following transactions are there.

Direct wages	150000
Indirect wages	10000
Factory overhead allocated to the production	44000
Administrative overhead allocated to the production	24000
Material provided to the production	98000
Cost of finished goods during the year	360000
Sales of finished goods-cost price	380000
Purchase of material	100000
Material provided to the factory for repairing	4000
Rate of goods inward for the material provided to the factory	1600
Factory overhead	29000
Administrative overhead	23400
Sales	420000

Q.4 Write short notes. (any two) (14)

1. Advantages and limitation of Bench marking.
2. Meaning and importance of common size cost and inter firm comparison methods.
3. Meaning utility and limitations of Balance score card.
4. Meaning and objectives of Inter-firm comparison

Q.5 Write short notes. (any two) (14)

1. Break even point and key factors.
2. Difference between integral and non integral method.
3. Objective and limitation of common size method of costing.
4. Advantages and disadvantages of non-integral system of accounting.
